

ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ

પ્રથમ : ૬

[૧૯૮૫થી ૧૯૭૫]

ગાંધીયુગીન-અનુગાંધીયુગીન ગંધસર્જકો

સંપાદક
રમેશ ર. દવે

સંપાદન-સંખ્યા
પારુલ કંઈ દેસાઈ

પચામશીકી
ચિમનવાલ નિવેદી

First Edition: October, 2006



કસ્તૂરભાઈ લાલભાઈ સ્વાધ્યાયમંદિર
ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ

● હિન્દુસાદ મણિરાય વાસ ●

(૨૫-૫-૧૯૮૦ - ૧૩-૭-૧૯૮૦)

ગુજરાતી બાળસાહિત્યમાં બકોર પટેલ અને શકરી પટલાણી જેવાં બાળપ્રિય અને અમર પાત્રો સંક્રનારા હિન્દુસાદ વ્યાસનો જન્મ વડોદરા જિલ્લાના બોડકા ગામે થયો હતો. ૧૯૨૧માં મેઢિક થયા પછી ૧૯૨૫થી એમણે ગેનિથ લાઈફ એન્ડ જનરલ ઇન્સ્યુરન્સ કંપનીને એજન્ટી-ઓફિસમાં મેનેજર તરીકે સેવાઓ આપી હતી. કેવિશીરનિયાના સાનાંહોરોમાં એમનું અવસાન થયું હતું.

હિન્દુસાદ વાસે મેટે ભાગે બાળકો માટે જ સાહિત્યસર્જન કર્યું પરંતુ એ સથાનું મોટેરાંઝોએ પક્ષ હોંસીઠોંશે, મજાખી માણનું છે. રત્નાજાન બધા વગ્નિના લોકીના જીવનનું સૂક્ષ્મ અવલોકન કરનારા હિન્દુસાદ, તે સમયે પ્રકાશિત થતા બાળસાહિત્યના પખવાઈક 'ગાંધીવા'માં પશુસુદ્ધિનાં બકોર પટેલ, શકરી પટલાણી, હાથીશાંકર ગેંકર - જેવાં પાત્રો ધરાવતી. 'બકોર પટેલની કથાઓ' લાપીને બાળવાચકોને પ્રસાન કરી દીધાં અને 'ગાંધીવા'નાં પ્રતિજ્ઞા-ગૌરવ વધાર્યો. બકોર પટેલના પાત્રની વિશેષતા એ છે કે એમની લોકપ્રિયતા સાત સમદર ઓળંગી ગઈ છે. ફંસના પાટનગર પરિસના એક સંગ્રહાલયમાં બકોર પટેલના પાત્રને સ્થાન આપવામાં આવ્યું છે.

એમણે બકોર પટેલની પદેલી વાર્તા ૧૯૭૪માં લખી હતી. એ પછી આ પાત્રનું એવું જાહુ પથરાયું કે બકોર પટેલ કથામાળાનાં બકોર પટેલની વાર્તા, કથાઓ, ગમતો, ગોટાળા, ફંજેતા, રમૂજો, પરાકરો અને છબરડા દ્વારા હાસ્ય તથા મનોરંજન પીરસતી ઉછ્વસિતકર્તાની ૧૯૮૦ સુદીમાં પ્રગત થઈ છે. બકોર પટેલ ઉપરાંત તેમની પાસેથી હાસ્યકથાઓ 'લંબોદર શર્મા' (૧૯૪૪), 'શ્રીમાન બોટાશાંકર અને ચીનના શાહુકાર'

બાળસાહિત્ય ● ૩૮૫

(૧૯૫૭), 'પરદુઃખબંજન પશાકકા' (૧૯૫૪) વગેરે મળે છે. લંબોદર શર્માનું (૧૯૫૭), 'પરદુઃખબંજન પશાકકા' (૧૯૫૪) વગેરે મળે છે. લંબોદર શર્માનું મૂળાળવાપણું કથામાં હાસ્યનું નિમિત્ત પૂરું પાડે છે તો ભારેખમ ભોટવાશાંકરની રચનાની પણ હાસ્ય ઉત્પાન કરે છે. આ બંને કથાઓમાં રીખણ, અટકચાળાં અને તોકણ-મસ્તીમાંથી ઊંઘી થતી સમૂજોરક પરિસ્થિતિ બાળકોને મનોરંજન પૂરું પાડે છે. પરદુઃખબંજન પશાકકા બીજાને મદદ કરવા માટે પોતે જે રીતે હેરાન થાય છે તે સમૂજોરક હાસ્ય નિપાતે છે. આ ઉપરાંત એમણે 'બેળાલાજ ભગાલાઈ' ૧-૬ (૧૯૭૨), 'હાથીશાંકર ધમધમિયા' ૧-૬ (૧૯૭૨), 'નુદરસુંદર' ૧-૬ (૧૯૭૨), જેવી પુસ્તકાશ્રીઓને તથા 'હાસ્ય ઝરણા' (૧૯૩૩), 'હાસ્યકિલ્લોલ' (૧૯૩૩), 'કથાખાસ્ય' (૧૯૪૨), 'પોથીમાંનાં રીંગણાં' (૧૯૫૮) જેવા હાસ્યલેખના સંગ્રહી અને 'બાળતિનોદ', 'હાસ્યવિનોદ', 'આનંદતિનોદ' જેવી નાનીમોરી અનેક કથામાળાઓ આપી છે. 'ચાલો ભજવીએ' (૧૯૬૪)ની દસ પુસ્તકાઓ આપીને બાળનાટક કેત્રને પણ એમણે સમૃદ્ધ કર્યું છે.